

સોશીયલ મીડીયા ફેસબુક/ઇન્સ્ટાગ્રામ ઉપર ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગત ફોટોગ્રાફ શેર કરનાર

આરોપીઓને ઝડપી પાડતી, સુરત શહેર સાયબર ક્રાઇમ.

તા.૨૭/૦૮/૨૦૧૯ ના રોજ પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફીકની હકીકત બાબતે સંયુક્ત કામગીરી કરવા અંગે મીટીંગ રાખવામાં આવેલ જે મીટીંગમાં પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલ ખાતે CCPWC પોર્ટલ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, રેપ, ગેંગરેપને લગતી ઓનલાઇન ફરીયાદ કરવા માટે કાર્યરત હોય, સદરહું પોર્ટલ ઉપર National Center for Missing & Exploited Children નામની સંસ્થા U.S. દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપ્સ આપવામાં આવેલ જે આધારે સાયબર ક્રાઇમ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૧/૨૦૧૯ આઇ.ટી.એક્ટ કલમ-૬૬(ઇ), ૬૭, ૬૭(એ), ૬૭(બી) તથા પોક્સો એક્ટ-૨૦૧૨ ની કલમ-૧૩, ૧૪(એ) તથા The Indecent Representation of woman (Prohibition Act) 1986 ની કલમ-૪(એ), ૬ મુજબનો ગુન્હે દાખલ કરવામાં આવેલ. જે ગુન્હામાં સંડોવાયેલ આરોપીની ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) રોહીતભાઇ નરસિંહભાઇ ગાફીયા ઉ.વ.૩૫ ધંધો-હિરા ઘસવાની મજૂરી રહે.ઘર નં.૮૨, ઉદયનગર-૨, કતારગામ આશ્રમ પાછળ, કતારગામ, સુરત મુળ રહે. ૮, મહાવીર જીન પાછળ, બરવાળા ઘેલાશા, તા.બરવાળા જી.બોટાદ (૨) જફર હસન મહેંદી ઉ.વ.૩૮ ધંધો-મજૂરી રહે.બિલ્ડીંગ નં.૪૫, રૂમ નં.૧૧, ગોલ્ડન આવાસ, ઉનપાટીયા, સુરત. મુળ રહે.બડી બાજાર, રસુલપુરા મહોલ્લા, કાશી બનારસ જી.કાશી બનારસ (ઉત્તરપ્રદેશ) (૩) આશારામ ચૌથીરામ બિંદ ઉ.વ.૩૩ ધંધો-એમ્બ્રોડરીનું રહે.ઘર નં.૧૫, રામેશ્વર કોલોની, કલર ટેક્સ કંપનીની પાસે, ગભેણી રોડ, સચીન, સુરત મુળ રહે.ગામ-પ્રાણનાથપુર કાયસ્થ તા.કાદિપુર જી.સુલતાનપુર (ઉત્તરપ્રદેશ) (૪) રાજેશ ઉર્ફે રાજુ ડ/૦ બચુભાઇ વિરાભાઇ સાંખટ ઉ.વ.૨૩ ધંધો-હિરા ઘસવાનું રહે.ઘર નં.૪૪, ભગીરથ સોસાયટી-૧, ભરતનગરની બાજુમાં, મારૂતી ચોક, વરાછા, સુરત મુળ રહે.ગામ-સુરવા તા.તાલાલા જી.સોમનાથનાઓને શોધી કાઢી ગુન્હાના કામે અટક કરી સદર આરોપીઓની પુછ પરછ કરતા તેઓએ ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગત ફોટોગ્રાફ/વિડીયો શેર કરેલ હોવાની કબુલાત કરેલ છે. તેમજ તેઓના મોબાઇલ ફોનમાં પોર્નોગ્રાફીને લગત સ્ત્રી, પુરૂષોના વિડીયોઝ તથા ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગત વિડીયો પણ મળી આવેલ છે.